

ક્રમ	અરજદારશ્રી નું નામ	અરજી ની વિગત	સંબંધિત કચેરી વિભાગ	અમલવારી બાબતે ભલામલ	રીમાર્ક્સ
૧	શ્રીમતી જયાબેન શંભુભાઈ ટોપીયા	તારીખ : ૧૫/૦૩/૨૦૧૬ ના રોજ અરજદારના સર્વે નંબર ૪૨૮/૧ પૈકી -૧ માં વાવેલ શેરડી ના પાકને શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગવાથી થયેલ નુકશાન	પ.ગુ.વી.કં.લી. ગ્રામ્ય પેટા વિભાગીય કચેરી ધોરાજી	સદર બનાવ અંગે અત્રે ની કચેરી દ્વારા તારીખ ૧૬/૦૩/૧૬ ના રોજ સ્થળ રોજકામ કરવામાં આવેલ છે. તેમજ આ અંગે ના તમામ ડોક્યુમેન્ટ પત્ર નંબર ડીઆરએસડી/ટેક-૧/૭૭૩૫ તારીખ ૧૬/૦૩/૧૬ ના રોજ ધી ઓરીએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લીમીટેડ - મહેસાણા ને મોકલી દેવામાં આવેલ છે. તેમજ આ બાબતે પ.ગુ.વી.કં.લી. નિગમિત કચેરી રાજકોટ દ્વારા તારીખ ૧૩/૦૫/૧૬ ના રોજ ઇન્સ્યોરન્સ કંપની સાથે ફોલોઅપ લેતા ઇન્સ્યોરન્સ કંપની દ્વારા જણાવેલ કે સદર કેસ માં કોપ પોલીસી ની વધુ માં વધુ લીમીટ મુજબ રૂ ૩,૦૦,૦૦૦/- અંકે રૂપિયા ત્રણ લાખ પુરા તારીખ ૦૮/૦૫/૧૬ ના રોજ સેટલ્ડ કરેલ છે. ઇન્સ્યોરન્સ કંપની દ્વારા મોકલેલ કોપ ઇન્સ્યોરન્સ સ્ટેટસ ની નકલ આ સાથે સામેલ છે.	નિકાલ
૨	શ્રી અલ્પેશભાઈ મોહનભાઈ જાગણી	અરજદારશ્રી ને સામાન્ય યોજના હેઠળ ની ખેતીવાડી અરજી તારીખ : ૦૮/૦૯/૧૫ ને સોલાર સ્કીમ હેઠળ સમાવેશ કરવા તથા સોલાર સ્કીમ હેઠળ ખેતીવાડી વીજ જોડાણ આપવા બાબત.	પ.ગુ.વિ.કં.લી. ગ્રામ્ય વિભાગીય કચેરી - ધોરાજી.	અરજદારશ્રી એ સામાન્ય યોજના હેઠળ ખેતીવાડી વીજ જોડાણ અરજી તારીખ : ૦૮/૦૯/૧૫ ના રોજ કરેલ હતી. અરજદારની સામાન્ય યોજના હેઠળની આ અરજી ને સોલાર સ્કીમ હેઠળ ઓબ્યુષ્મેન્ટ ના હુકમ મુજબ રૂા. ૧૦૦૦ ભરપાઈ કરાવી તારીખ : ૧૦/૦૩/૧૬ ના રોજ તબદીલ કરેલ છે. હાલમાં વર્ષ ૨૦૧૫/૧૬ ના પ.ગુ.વિ.કં.લી. ના ટાગેટ મુજબ કુલ ૧૪૯૬ અરજદાર ને સોલાર સ્કીમ હેઠળ વીજ જોડાણ આપવાનું નક્કી કરેલ છે. વર્ષ ૨૦૧૫/૧૬ માં સોલાર સ્કીમ હેઠળ પ.ગુ.વિ.કં.લી માં કુલ ૨૭૨૧ અરજદારોની અરજી આવેલ છે. જેથી વર્ષ ૨૦૧૫/૧૬ માં ટાગેટ એચિવ કર્યા બાદ ૧૨૨૫ અરજદારોની અરજી પેન્ડિંગ રહેલ છે. આ બાકી રહેતા અરજદારોની અરજી નો નિકાલ આગામી વર્ષમાં પ.ગુ.વિ.કં.લી નિગમિત કચેરી - રાજકોટ દ્વારા મંજૂરી મળ્યા બાદ અગ્રતા કમ ધોરણે કરવામાં આવશે. સદર અરજદારને પણ બાકી રહેતા અરજદારમાં સમાવેશ કરવામાં આવેલ છે.	નિકાલ
૩	શ્રી સાયરા સાદીક વલીભાઈ સરપંચ શ્રી. ઉદકીયા ગ્રામ પંચાયત	ઉદકીયા ગામે પી.જી.વી.સી.એલ. ના તાર ગામતળ અને સીમતળ માં ખેંચવા અંગે.	પ.ગુ.વિ.કં.લી. ગ્રામ્ય પેટા વિભાગીય કચેરી - ધોરાજી	સદર બાબતે નાયબ ઇજનેર પ.ગુ.વિ.કં.લી. ગ્રામ્ય પેટા વિભાગ કચેરી - ધોરાજી દ્વારા સ્થળ પર તારીખ : ૧૩/૦૫/૧૬ ના રોજ સરપંચશ્રી સાથે રૂબરૂ મુલાકાત લઈ સ્થળ પર જ ગામતળના પ્લોટ વિસ્તારમાં ઢીલા તાર તેમજ સીમતળના ગોપાલભાઈ અરજણભાઈ વાળા ખેતીવાડી ગ્રુપના ઢીલા તાર નું નિરીક્ષણ કરેલ અને આ કામગીરી દિવસ - ૮ માં પૂર્ણ કરવાની ખાત્રી નાયબ ઇજનેર પ.ગુ.વિ.કં.લી. ગ્રામ્ય પેટા વિભાગ કચેરી - ધોરાજી દ્વારા આપવામાં આવેલ છે. ત્યારબાદ નાયબ ઇજનેર પ.ગુ.વિ.કં.લી. ગ્રામ્ય પેટા વિભાગ કચેરી - ધોરાજી દ્વારા તારીખ : ૧૭/૦૫/૧૬ ના રોજ સરપંચશ્રી ની માંગણી મુજબની ખેતીવાડી સીમતળ માં શ્રી. ગોપાલભાઈ અરજણભાઈ વાળા ગ્રુપમાં ૧૨ ગાળાના ઢીલા વાયર ખેંચી ટાઈટ કરેલ, ૨ પોલ નમેલ સીધા કરેલ તેમજ ૬ ઘાય સેટ લગાડેલ છે. તેમજ ગામતળ માં પ્લોટીંગ વિસ્તારમાં ૫ ગાળાના ઢીલા વાયર ખેંચીને ટાઈટ કરેલ છે.	નિકાલ